

MONARCH
NETWORK CAPITAL

28th July, 2021

To,
The Manager - CRD
BSE Limited,
Phiroze Jeejeebhoy Tower,
Dalal Street, Fort,
Mumbai - 400 001

Dear Sir,

Sub: Submission under Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Ref: Company Code 511551

With regards to the captioned subject, we enclosed herewith copy of e-newspaper of Extract of Un-Audited Standalone & Consolidated Financial Result's of the company for the Quarter ended 30th June, 2021 which has been published today i.e. on Wednesday, 28th July, 2021 in "Economic Times", "Gujarat Today" and "Gujarat Samachar".

This is for your information and records pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Thanking you.

Yours faithfully,

For Monarch Network Capital Limited

Rupali Verma
Company Secretary & Compliance Officer
Membership No.A42923



Encl: a/a

Monarch Network Capital Limited (CIN: L65920GJ1993PLCI20014)

Regd. Off.: Unit No. PO4-01D, 4th Floor, Tower A WTC GIFT CITY, Block No. 51, Road 5 E, Zone-5, Gandhinagar - 382355, Gujarat

Corp. Off.: "Monarch House", Opp Prahladbhai Patel Garden, Near Ishwar Bhuvan, Commerce Six Roads, Navrangpura, Ahmedabad - 380009

T: +91-079-266 66 500 / +91-079-660 00 500 | **E:** reachus@mnclgroup.com | **W:** www.mnclgroup.com

Foreign FIs Halt Plans to Set Up Investment Firms within IFSCs

Worry about ambiguity over trade pacts even as Indian funds explore new structures

Sachin.Dave@timesgroup.com

Mumbai: Many foreign financial institutions looking to set up investment entities within the Indian International Financial Services Centres (IFSCs) are on pause mode pending negotiation of the terminated bi-lateral trade agreements with 58 countries.

A European fund that was looking to set up a base in India stumbled into a roadblock after some of the legal advisers pointed out that India doesn't have trade treaties in place with several countries.

The fund is now setting up an India-focused fund with a pooling vehicle being set up in Luxembourg, a person with direct knowledge of the matter told ET.

"Many foreign financial institutions are yet to evaluate IFSC and empanel it in their list of approved jurisdictions. Absence of trade agreements is deterring many financial institutions from making direct investments in fund set-up or proposed to be set up in India," said Yashesh Ashar, partner at Bhuta Shah & Co, a tax advisory firm.

On Pause Mode

While foreign funds are putting their plans on hold, Indian funds are looking to explore new structures in IFSCs such as Gujarat

Many domestic funds are exploring to set up entities within GIFT City in a way that they can manage large pools of money meant for investment within and outside India

At least a dozen Indian entities are looking at GIFT city

foreign companies' domestic assets including copyright and intellectual properties. In most cases foreign companies are more bothered about such pacts as compared to say financial investors or funds, say industry trackers.

However this is becoming one of the reasons why foreign funds are treading cautiously, say insiders. At the same time many Indian funds or funds backed by Indian banks, financial institutes and Indian companies are looking at these centres as an opportunity.

Many domestic funds are exploring to set up entities within GIFT City in a way that they can manage large pools of money meant for investment within and outside India. Tax experts point out that many Indian entities are looking to explore several advantages offered by GIFT City.

"Offshore investments by Indian high networth individuals (HNIs) are slowly catching up with the rest of the developed world as Indians are becoming more sophisticated investors. Some fund managers are seriously considering setting up a GIFT City fund for pooling Indian money to invest abroad.

Hotel Check-ins Rise as Leisure Travel Picks Up

NEW DELHI: Hotel occupancies in all the major cities witnessed a month-on-month increase with the revival in leisure travel in June, according to HVS Anarock's latest Hotels & Hospitality Overview report.

Mumbai observed the highest occupancy (61-63%) in June, followed by New Delhi (59-61%), primarily driven by staycation and weekend businesses. All India average occupancies were between 30% and 32% in June, up by 12-14 percentage points month-on-month, while average daily rates were up 14-16% month on month

and were between ₹3,600 and ₹3,800. Revenue per available room was ₹1,080-1,250 in June, up 93-95% month on month.

On a year-on-year basis, average daily rates went up by 17-19% while occupancy rates went up by 10-12 percentage points in June. Revenue per available room was up by 78-80% on-year in June.

The report also said that hotel stocks are seeing an upward trend with Indian Hotels Company (IHCL) outperforming the market in recent months.

Brand openings and signings by properties have increased marginally in IH21 compared to last year. In IH21, hotel operators have signed smaller hotels with increased focus on tier-3 and tier-4 cities. In the first half of this year, 19 hotels spanning 1,910 keys opened for guests compared to 14 hotels covering 1,361 rooms in the first half of last year. In the first half of this year, 49 hotels spanning 4,401 rooms were signed compared to 46 hotels covering 4,998 rooms in the first half of 2020. — Anumeha Chaturvedi

INSTITUTE OF ENTREPRENEURSHIP DEVELOPMENT
Micro, Small & Medium Enterprises & Export Promotion
A-1 & 2, Industrial Area, Sarojini Nagar, Kanpur Road, Lucknow-226008

2 DAYS ENTREPRENEURSHIP DEVELOPMENT PROGRAM ON
ELECTRIC VEHICLE (EV) CHARGING STATION INFRASTRUCTURE & TECHNOLOGY

Course Duration (ONLINE) Dates: 31st July & 01st August, 2021
Time: 10.00 AM to 5.00 PM
Time: 10.00 AM to 5.00 PM

COURSE CONTENT: EV Charging Stations & Technologies, Types of Charging Stations, Implementation Mechanism, Tariff rate for Supply Electricity to EV PCS, Solar-Powered EV Charging stations Technology, ROI Calculation, Business/ Startup Opportunities/Rate Contract/Land Leasing, Govt. Scheme, More

FEE - 2,999/-

Mob: 08800609856 / 0859257827

CERTIFICATE WILL BE AWARDED BY IEDUP | Website: www.iedup.in

INSTITUTE OF ENTREPRENEURSHIP DEVELOPMENT, U.P., LUCKNOW
(Micro Small & Medium Enterprise and Export Promotion, Govt. of U.P.)
A-1 & 2, Industrial Area, Sarojini Nagar, Kanpur Road, Lucknow -226 008, UP

Notification No. Dir/2021/004
Website: www.iedup.in

1. Applications are invited from universities/institutions/NGOs/Government bodies/companies from all the states & U.Ts of India including 18 mandals of U.P. who have adequate infrastructure and experts, can coordinate with government, Private sectors and local bodies to meet the vision and objectives of IEDUP, to work as regional center of IEDUP in the domain of skill, research, training, entrepreneurship development, employment generation etc.

2. Invites expression of Interest of the following digital material and aids for graduate Medical and allied education:
• Curriculum-based digital educational content for health sector Undergraduate courses MBBS, BDS, B.Sc (Nursing), BHMS as per the norms/ standards set by the national regulators. • Digital education packages for vocational courses, skill development and employability. • Digital education packages for test preparation. • *Online /blended formats for continuing education for GPs, public health and allied health professionals.

Those who are interested may send their profile and details on email director.ied@gmail.com with POA and DD of Rs. 25000/- in favour of Institute of Entrepreneurship Development, U.P., Lucknow within 30 days. Institute has all the rights to accept or reject any or all proposal without assigning any reason there for.

Lucknow
Date: 27.07.2021
Sd/-
Director, IEDUP

Handsets Supporting All 5G Frequencies may Cost More

Telcos want devices to support all bands as they repurpose 4G waves for 5G

Danish.Khan@timesinternet.in

New Delhi: Smartphone makers bringing out products in India supporting 5G bands are relevant for the country but launching devices that support all global 5G frequencies at this stage will increase the prices for consumers in a value-conscious market. "N78 band is emerging as the priority band in India. Our intent for the Indian market is to provide 5G bands support across the product line," Navmit Nakra, vice president, chief strategy officer of OnePlus India told ET.

N77 and N78 bands operate within 3200 MHz to 4200 MHz frequency range.

For now, India has earmarked 3300-3600 MHz bands for 5G. But Indian telcos telecom operators use spectrum in the 1800, 2100, 2300 MHz bands as well as those in the 800 and 900 MHz bands to currently offer 4G. But all of these can be repurposed in future to offer 5G, and thus want handset makers to support all available global 5G bands.

India's second-largest telco Bharti Airtel recently urged the Department of Telecommunications (DoT) to bring guidelines so that any new 5G hand-

Issue at Hand

N77 and N78 bands operate within 3200 MHz to 4200 MHz frequency range

India has earmarked 3300-3600 MHz bands for 5G



Airtel recently urged DoT to bring guidelines so that any new 5G handset sold in India supports all existing bands for 5G

et sold in India support all existing bands for 5G.

Madhav Sheth, chief executive officer of Realme India, said his brand was ensuring C-band support, including N77 and N78, across its 5G portfolio along with various other 5G bands.

"Across various price categories, we have support for multiple 5G bands, starting from our most affordable 5G smartphones," Sheth said.

However, an executive with a leading Chinese maker said brands are conscious about pricing of their 5G smartphones. Hence, there are limited bands available in some of the models, foreseeing no use soon. India is currently holding 5G trials with auctions expected only in 2022.

Samsung, Vivo and Oppo didn't respond to ET's queries.

DLF Set to Enter Mumbai by Fiscal-end

NEW DELHI: DLF will soon enter the Mumbai market even as the company is finalising plans to monetise its land bank in Nagpur and Pune. DLF's newly appointed chief executive Ashok Tyagi told investors in post-earnings call for Q1 on Tuesday.

"Tulsiwadi in Mumbai is something we are looking to monetise and we feel now is the right time to take it to the market," Tyagi said.

With a development potential of 9 lakh sq ft and a premium location, the company is expected to launch high-end residential towers by the end of this fiscal.

"A lot of local players are approaching us from Mumbai and we are in discussions with them. We don't want to be on our own and there are multiple proposals. We are currently evaluating all the proposals," Tyagi said.

The real estate developer is also looking at entering the Noida market and has been evalu-

ating a stressed asset in that market.

DLF reported a net profit of ₹337.17 crore for the quarter ended June compared to a loss of ₹71.52 crore in the corresponding quarter last year as strong demand in residential business buoyed overall sales.

The consolidated revenue of the company stood at ₹1,243 crore, reflecting a 92% on-year increase.

Net sales bookings stood at ₹1,014 crore, reflecting 567% growth on-year.

"Sale of super luxury apartments in The Camellias and independent floors have contributed ₹900 cr of the sale. While demand for large apartments has pushed the sale for Camellias, many fence sitters have bought after we launched the club," said Aakash Ohri, senior executive director of DLF Home Developers. — Faizan Haidar

Kirloskars in a Tussle Over Right to Claim 130-yr Legacy

Our Bureau

Mumbai: A tussle is brewing again in the Kirloskar family after Kirloskar Brothers (KBL), chaired by Sanjay Kirloskar, objected to the mention of the 130-year legacy of the company by other Kirloskar companies led by Atul and Rahul Kirloskar.

Companies led by Atul and Rahul Kirloskar had earlier this month launched a new group strategy with focus on getting into consumer-centric segments and modernising their business processes. The companies also adopted a new logo.

The companies include Kirloskar Oil Engines, Kirloskar Industries, Kirloskar Pneumatic Company and Kirloskar Ferrous Industries. As part of the ad campaign for this, the companies drew upon the 130-year legacy of the Kirloskar name. KBL has contested this marketing by staking exclusive claims over legacy of the Kirloskar name.

This is not the first time that the brothers have publicly exchanged punches. There is an ongoing feud amongst the fourth generation of the industrialist family over a deed of family settlement pertaining to assets of the group. Atul and Rahul along with the rest of the family are on one side and their brother Sanjay Kirloskar is on the other.

Companies led by Atul and Rahul Kirloskar have launched a new group strategy with focus on consumer-centric segments

Q1 FY 22 Performance

Consolidated Net Profit up by **99%** to **₹1,016 crs** (Y-o-Y)

Deposit up by **26%** (Y-o-Y)

Saving Deposit up by **52%** (Y-o-Y)

CRAR at **17.57%**

NNPA at **0.84%**

MONARCH NETWORK CAPITAL
CIN: L65920G1993PLC120014

Regd. Office: Unit No. PO4-01D, 4th Floor, Tower A, WTC GIFT CITY, Block No. 51, Road 5 E, Zone-5, Gandhinagar - 382355, Gujarat
Corporate/ Communication Address: "Monarch House", Opp Praladhai Patel garden, Near Ishwar Bhuvan, Commerce Six Roads, Navrangpura, Ahmedabad - 380009
Tel No.: 91-079-26666500; Email: cs@mncigroup.com; Website: www.mncigroup.com

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2021
(Rs. In Lacs except EPS)

Sr. No.	Particulars	Consolidated			Standalone		
		Quarter Ended 30.06.2021	Quarter Ended 30.06.2020	Year Ended 31.03.2021	Quarter Ended 30.06.2021	Quarter Ended 30.06.2020	Year Ended 31.03.2021
		Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Audited
1.	Total income from Operations (Net)	3,491.0	1,589.9	10,308.8	3,248.6	1,454.6	9,266.5
2.	Net profit / (loss) before Tax (before exceptional and extraordinary items)	1,859.7	264.9	3,968.0	1,583.5	210.9	3,408.3
3.	Net profit / (loss) before Tax (after exceptional and extraordinary items)	1,859.7	264.5	3,482.8	1,583.5	210.6	2,924.7
4.	Net profit / (loss) after Tax (after exceptional and extraordinary items)	1,351.5	188.7	2,434.6	1,162.6	145.9	2,039.7
5.	Total Comprehensive Income [Comprising profit/loss for the period (after tax) and other comprehensive income (after tax)]	1,509.0	193.4	2,572.7	1,320.2	150.6	2,178.0
6.	Paid-up Equity Share Capital	3,104.95	3,104.95	3,104.95	3,104.95	3,104.95	3,104.95
7.	Earnings per Equity Share (Rs.)						
	(i) Basic (after extra-ordinary items)	4.86	0.62	8.29	4.25	0.48	7.01
	(ii) Diluted (after extra-ordinary items)	4.86	0.62	8.29	4.25	0.48	7.01

Note: The above is an extract of the detailed format of Quarterly Unaudited Results filed with BSE Limited under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the following weblinks:
1) On the BSE Limited: <https://beta.bseindia.com/stock-share-price/monarch-network-capital-ltd/monarch/511551/>;
2) On Company's website: <https://www.mncigroup.com/investor-relation/investor-relation-financials-quarterly-results>.
3) #AIF related disclaimer: i) MNCL Capital Compounder Fund (SEBI Registration No. IN/AIF3/20-21/0787) is the maiden long only Cat 3 AIF Equity Fund of Monarch. AIF which in turn is sponsored by Monarch Network Capital, ii) Fund inception date is 23rd Oct, 2020 and AIF returns are from 23rd Oct, 2020 to 26th July 2021, iii) Returns are net of fees and transaction costs and includes dividend income but are on pre-tax basis, iv) Nifty50 TRI returns on pre-tax basis during the same period stood at 34.4%.

By order of the Board of Directors
For Monarch Network Capital Limited
Sd/-
Vaibhav Shah
Managing Director
DIN: 00572666

Place : Ahmedabad
Date : 27th July, 2021

IndusInd Bank

CIN: L65191PN1994PLC076333 | Regd. Office: 2401, Gen. Thimmayya Road, Cantonment, Pune - 411 001.
Corporate Office: 8th Floor, Tower 1, One Indiabulls Centre, 841 S. B. Marg, Elphinstone Road, Mumbai - 400 013.

(₹ in Lakhs)

Unaudited Financial Results for the quarter ended June 30, 2021

Particulars	Consolidated			Standalone		
	Quarter ended 30.06.2021 (unaudited)	Year ended 31.03.2021 (audited)	Quarter ended 30.06.2020 (unaudited)	Quarter ended 30.06.2021 (unaudited)	Year ended 31.03.2021 (audited)	Quarter ended 30.06.2020 (unaudited)
Total income from operations	936276	3550068	868217	935577	3555841	868092
Net Profit / (Loss) for the period (before tax, exceptional and /or extraordinary items)	134147	392942	66886	128654	378414	60245
Net Profit / (Loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	134147	392942	66886	128654	378414	60245
Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or extraordinary items)	101611	293010	51039	97495	283639	46064
Equity Share Capital	77388	77337	69357	77388	77337	69357
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of the previous year)	4241367	4241367	3306110	4227843	4227843	3301956
(As at 31.03.2021)	(As at 31.03.2021)	(As at 31.03.2021)	(As at 31.03.2020)	(As at 31.03.2021)	(As at 31.03.2021)	(As at 31.03.2020)
Earnings Per Share (of ₹10 each) (for continuing and discontinued operations) (not annualised)						
- Basic	13.14	40.03	7.36	12.60	38.75	6.64
- Diluted	13.11	39.96	7.36	12.58	38.68	6.64

Note:
1. The above is an extract of the detailed format of Quarterly / Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com and www.nseindia.com) and Bank website www.indusind.com.
2. Information relating to Total Comprehensive Income and Other Comprehensive Income are not furnished as Ind AS is not yet made applicable to banks.

Mumbai
July 27, 2021

Sumant Kathpalia
Managing Director & CEO

સોજિત્રાના પીપળાવ નજીકનો બનાવ આંગડિયા કર્મીઓની આંખમાં મરચુ નાંખી પલ લાખના દાગીનાની લૂંટ

આણંદ, તા.૨૭
આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. આણંદ-સોજિત્રા રોડ ઉપર પીપળાવ ચોકડીથી આગળ મોડી રાત્રે અમદાવાદની આંગડિયા પેઢીની ગાડી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી બે કારમાં અજાણ્યા શખ્સો આવ્યા અને કાર અટકાવીને કારનો કાય તોડી કારમાં મરચુ નાંખીને પલ લાખ ઉપરાંતના કિંમતના સોના, ચાંદીના દાગીના તથા કિંમતી હીરા ભરેલા થેલાની ચીલ ઝડપ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ સોજિત્રા પોલીસે થતા આણંદના ડીવાયએસપી સહિતનો ઉચ્ચ અધિકારીનો કાફલો પહોંચી ગયો હતો અને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે.



(તસવીર : ભુરહાન પઠાણ, આણંદ)


પ્રામ માહિતી અનુસાર, અમદાવાદના મહેન્દ્રકુમાર આંગડિયા પેઢીના કર્મચારીઓ ઈન્ડિયા ગાડી નં. (ચલ-૧૫-૬૬-૩૧૦૧) લઈને અમદાવાદથી વડોદરા ગઈકાલે ગયા હતા. ત્યાંથી આંગડિયા પેઢીમાં માલસામાન લઈને મોડી રાત્રે તારાપુર જવા નીકળ્યા હતા. રાત્રીના બારેક વાગ્યા બાદ આણંદ સોજિત્રા રોડ ઉપર પીપળાવ ચોકડીથી આગળ તેઓની કાર પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી બે કાર પુરજડપે આવી આંગડિયા પેઢીની કાર ને ફિલ્મી સ્ટાઈલે આંતરી હતી. આંગડિયા પેઢીની કારને અટકાવીને લૂંટારુઓએ ગાડી ઉપર કારના આગળના ભાગે દંડો મારી કાય તોડી નાખી કારમાં બેસલ કર્મચારીઓની આંખમાં મરચુ નાંખ્યું હતું અને કારના દરવાજા ખોલી દિલ્લપડક રીતે હીરા અને સોના ચાંદીના દાગીના ભરેલા થેલાની સનસનાટી લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ફરિયાદીએ પોલીસ ને આપેલ માહિતી મુજબ આ મુદ્દામાલની કિંમત પલ, ૮૪, ૦૦૦ જેટલી હોવાનો અંદાજ છે. વધુ માહિતી અનુસાર બે કારમાં ૮ થી ૧૨ લોકો આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ

લોકો વડોદરાથી તેઓનો પીછો કરતા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમ મોડી રાત્રે પીપળાવ સોજિત્રા રોડ ઉપર લાખોની રકમના દાગીના અને હીરાની લૂંટ થતા ભય અને અસલામતીનો માહોલ ઉભો થયો છે.

આ બનાવની જાણ થતા સોજિત્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વહેલી સવારે આણંદના ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ લૂંટના પગલે ઘટનાસ્થળે દોડી ગયા હતા. લૂંટારુઓને પકડી પાડવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે તેમજ દરેક પોલીસ સ્ટેશનમાં લૂંટનો સંદેશો મોકલી લેવામાં આવ્યો છે. હાલમાં તો આ અંગે સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી રહી છે.

મહિલા અને બાળવિકાસ આંગણવાડીના પુસ્તકમાં ગંભીર છબરડો પાઠ્યપુસ્તકમાં રાષ્ટ્રધ્વજને ડાબા હાથે સલામી આપતા જવાનનું ચિત્ર છપાયું

મોડાસા, તા.૨૭
ગુજરાતમાં પાઠ્યપુસ્તકોમાં ઘણીખંપત પ્રિન્ટિંગમાં ભૂલો થતી હોય છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં ઈતિહાસ અને ફોટા પણ બદલાઈ ગયા હોવાના અનેક છબરડા બહાર આવતા હોય છે ત્યારે રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલીત આંગણવાડીના પુસ્તકમાં ગંભીર ભૂલ હોવાનું બહાર આવ્યું છે. રમત-ગમત ભાગ-૧ ના પુસ્તકમાં રાષ્ટ્ર ધ્વજને ડાબા હાથે સલામી આપતા જવાનનું ચિત્ર છપાવવામાં આવ્યું છે જાગૃત વાલીઓ આંગણવાડી પાઠ્યપુસ્તકમાં થયેલા છબરડા સામે આકોશ વ્યક્ત કરવાની



સાથે બાળકના જીવન શીક્ષણની શરૂઆતમાં જ ભૂલ ભરેલું પુસ્તક થી

ખોટી અસર પડી શકે તેમ હોવાથી પુસ્તકમાં રહેલી ભૂલ સુધારવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે. રમત-ગમત ભાગ-૧ રંગપૂર્ણ પુસ્તકના ૨૮ માં પાના પર રાષ્ટ્રધ્વજને ડાબા હાથે સલામી આપતા જવાનનું ચિત્ર છાપી ગંભીર ભૂલ સાથે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હોવાનું વાલીઓ અહેસાસ કરી રહ્યા છે આંગણવાડી વિભાગના જવાબદાર અધિકારીઓને આ ગંભીર ભૂલ સામે કેમ ધ્યાન નહીં ગયું હોય બાળકોને શીક્ષણ જીવનના શરૂઆતમાં જ ખોટી રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપવાનું માનસ પર અસર કરી શકે છે.

ભારતની બોક્સર લવલીનાનો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ, જર્મની સામે ૩-૨ થી જીતી

ટોક્યો, તા.૨૭
ટોક્યો ઓલિમ્પિક્સની બોક્સિંગ રિંગમાં, ભારતના પુરૂષ બોક્સરો એક પછી એક નિષ્ફળ રહ્યા છે. પરંતુ મહિલા બોક્સરોએ જીત સાથે પોતાનું ખાતું ખોલાવ્યું છે. મેરીકોમ પછી ભારતની લવલીનાએ પણ વેલ્ટરવેઈટ કેટેગરીમાં તેની મેચ જીતી લીધી છે. લવલીનાએ ૧૬ ના રાઉન્ડમાં જર્મનીના ઘણા અનુભવી બોક્સરને હરાવી. ભારતની મહિલા બોક્સરે આ મેચ ૩-૨ થી જીતી હતી.

થયો તો ભારતના ખાતામાં જીત આવી હતી, ભારતની લવલીનાએ રાઉન્ડ ઓફ ૧૬ ના આ મુકાબલો જીતી ક્વાર્ટર ફાઈનલની ટિકીટ કમાવી છે. ક્વાર્ટર ફાઈનલમાં હવે ભારતીય બોક્સર લવલીનાનો મુકાબલો ચીની તાઈપે ચેન નેનની સાથે થશે. ચીની તાઈપેની બોક્સરે રાઉન્ડ ઓફ ૧૬ માં મેચ ઈટલીની બોક્સરને હાર આપી હતી. ચીની તાઈપેની બોક્સરે આ મુકાબલો લવલીનાની સ્પિલિટ નિર્ણયથી જીત્યો છે.

જર્મની બોક્સરની સાથે લવલીનાનો મુકાબલાની જોરદાર શરૂઆત થઈ હતી. બંને બોક્સરો એક બીજા પર ભારે પડી રહી હતી. મુકાબલાના પ્રથમ રાઉન્ડમાં લવલીનાના નામે રહી હતી. ત્યારબાદ બીજા રાઉન્ડમાં જર્મનીની બોક્સરે પોતાના અનુભવનો સારી રીતે ઉપયોગ કર્યો હતો તેમ છતાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. બીજા રાઉન્ડમાં લવલીના બીજા રાઉન્ડમાં આગળ રહી હતી. પ્રથમ બે રાઉન્ડમાં ભારતની લવલીનાએ લીડ મેળવતી જોતા જ જર્મનીની બોક્સર વધુ ઉત્સાહ સાથે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ મુકાબલો જ્યારે પૂર્ણ

૨૦૧૮માં વર્લ્ડ ચેમ્પિયનશીપની સેમીફાઈનલ મુકાબલામાં ચેને લવલીનાને હાર આપી ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર કરી હતી. આ વખતે લવલીનાની પાસે બદલો લેવાની સુવર્ણ તક છે. લવલીના જુ આ મેચ જીતે છે તો તેમનો મેડલ પાકી છે.

ભારતીય હોકી ટીમે ત્રીજી મેચમાં સ્પેનને ૩-૦ થી હરાવ્યું

ટોક્યો, તા.૨૭
ભારતીય હોકી ટીમે પોતાની ત્રીજી મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરતા સ્પેનને ૩-૦ હરાવ્યું છે. આખી મેચ દરમિયાન ભારતીય ટીમ છવાયેલી રહી હતી. ટોક્યો ઓલિમ્પિક્સમાં આજે ભારતે તેની ત્રીજી મેચમાં સ્પેનને ૩-૦ થી હરાવ્યું હતું. સમગ્ર મેચમાં ભારતીય ટીમનો દબદબો હતો. તીક્ષ્ણ હુમલો અને મજબૂત સંરક્ષણ લાઈનની સામે, સ્પેનનો એક હાથ પણ નહોતો. ભારત તરફથી રૂપિંદર પાલે બે જયારે સિમરનજીતે એક ગોલ નોંધાવ્યો હતો. આ પહેલા ભારતે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ૭-૧ ની શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તેની પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને પરાજિત કર્યું હતું. ભારતીય પુરૂષ હોકી ટીમ સ્પેન પર જીત નોંધાવવાના ઈરાદે મેદાને ઉતરશે.

સીકોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સિયલ એક્સેસ એન્ડ એન્ગેજમેન્ટ ઓફ સીકોરિટી ઈન્ફ્રેસ્ટ્રક્ચર, 2002 (કાયદો) ની હલમ 13(2) અન્વયે સૂચના

ક્ર. નં.	કર્ણદાર (રો)ના નામ (ક)	ગોરો મૂકેલી વિલકતની વિગતો (ખ)	એનપીએ તારીખ (ગ)	બાકી રકમ (ઠા.) (ઠ)
૧.	લોન એકાઉન્ટ નં. HILAPBAR00253276	ફ્લોટ નં.-402, ઈરોસ અપાર્ટમેન્ટ, પ્લોટ નં.161 અને 162, વિભાગ ૬૦.ઓપરેટીવ સોસાયટી, કમલ ટોપિયલની પાછળ, સહોદરા, વડોદરા-390020, ગુજરાત	૩૧.03.2021	રૂ. 80,00,818.24/- (રૂપિયા અઠી લાખ આઠ સો અઠાર અને ચોવીસ પેસા માત્ર)૩૧.03.2021 ના રોજ

આ સાથે જણાવવાનું ઉપરોક્ત નામવાળા ધિરાણ લેનાર (રૂ) લોન અકાઉન્ટમાં નાણાંકીય ધિરાણ જાળવી રાક્યા નથી અને કંપનીના કામકામના સામાન્ય ધિરાણ મુજબ ધિરાણના ને ચોપડા તેમજ રકાચ છે તે મુજબ દરેક ધિરાણ લેનાર (રૂ) ના નામની સામે કોલમ (ઘ) માં દર્શાવાયેલ રકમ બાકી નીકળે છે.

ધિરાણ લેનાર (રૂ) લોનની રકમની પૂનઃ ચુકવણીની બાબતમાં સતત કસ્ટોડિયન ઠરતા રહેતા હોવાથી કંપનીએ નિર્ધારિત નિયમો હેઠળ ધિરાણ લેનાર (રૂ) ના લોન એકાઉન્ટને નોન પરફોર્મિંગ એકેટ (કોલમ ગ) માં દર્શાવેલ તારીખ પ્રમાણે) તરીકે વર્ગીકૃત કર્યો છે. ધારાની હલમ 13(2) હેઠળ દરેક ધિરાણ લેનારને સતત (નોટિસ) પણ મોકલવામાં આવી છે.

ઉપરોક્ત બાબતના સંદર્ભમાં આ નોટિસ છપાયાની તારીખથી 60 દિવસમાં આજ દિવસ સુધીના વ્યાજ, ખર્ચ અને બાકી રકમ કોલમ (ઘ) માં દર્શાવ્યા મુજબ ચુકવવા સહિત કોલમ (ઘ) માં દર્શાવાયેલ બાકી નીકળતી સમગ્ર રકમ ભરી દઈ પોતાની સંપૂર્ણ જવાબદારી પૂર્ણ કરવા કંપની તેને/તેણીને સેવાન કરે છે. જે તેમ નહીં થાય તો કોલમ (ખ) માં જણાવેલ ગિરો મુકાબલે અરજામતનો કલમો લેવા કંપની હકદાર રહેશે તેમ જ કંપની કાયદો હેઠળ ઉપલબ્ધ અન્ય પગલાં પણ લઈ શકશે.

કુલ કાયદો નીચે લેણો છે કે જે સેવો ઓફરની હલમ 13ની પેઠા હલમ (ઠ) ની નોંધવાઈએના સંદર્ભમાં, "કર્ણદાર બાકી નીકળતી સંપૂર્ણ રકમ સીકોરિટી ઈન્ફ્રેસ્ટ્રક્ચર દ્વારા ભરવા બંધી જાગશે, ચુકવણ અને ખર્ચ સહિત સીકોરિટી એક્સેસના પબ્લિક ઓફરના, સેવોઈએના મંત્રાલયને, પબ્લિક ઓફરની અવધ પ્રમાણે ટૂંકી સી ઈન્ફ્રેસ્ટ્રક્ચરને કરવાને સંબંધિત રકમના પ્રકાશિત વ્યાજની તારીખ સુધી ૧ વાર્ષિક ૧૨% રકમ, સુધમાં, એ પછા નોંધ લેણો કે જે કર્ણદાર ઉપર જણાવેલ કાયદોસર ચુકવ સમય સીમાની અંદર સીકોરિટી એક્સેસ વડાવ્યામાં નિષ્ફળ જયો તો કર્ણદાર પ્રોટી (નિલકત) વડાવ્યા હકદાર ન પણ રહે.

સરકારી કાયદોની હલમ 13 ની પેઠા હલમ (13) ની નોંધવાઈએના સંદર્ભમાં, તેમને દ્વારા કોઈ પણ, તેમના વેચાણમાંથી, વેચાણ, બાકાપટ્ટા અથવા અન્યથા (તેમના વ્યવસાયના સામાન્ય કોર્સ કિંવાય) સુરક્ષિત વેચાણની પૂર્વ લેખિત સંમતિ વિના નોટિસ ઉલ્લેખિત સુરક્ષિત સંમતિ ટ્રાન્સફર કરવાથી પ્રતિબંધિત છે.

સ્થાન: વડોદરા (ગુજરાત)

સહી-
ઈન્ડિયાનુલક ઉનાઈલ્સ લેડિટ લિમિટેડ વતી.
અધિકૃત અધિકારી

MONARCH NETWORK CAPITAL
Monarch Network Capital Limited
CIN: L65920GJ1993PLC120014


Regd. Office: Unit No. P04-01D, 4th Floor, Tower A, WTC GIFT CITY, Block No. 51, Road 5 E, Zone-5, Gandhinagar - 382355, Gujarat
Corporate/ Communication Address: "Monarch House", Opp Prahladhhai Patel garden, Near Ishwar Bhuvan, Commerce Six Roads, Navrangpura, Ahmedabad - 380009
Tel No.: 91-079-2666500; Email: cs@mnclgroup.com; Website: www.mnclgroup.com

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2021
(Rs. In Lacs except EPS)

Sr. No.	Particulars	Consolidated			Standalone		
		Quarter Ended 30.06.2021	Quarter Ended 30.06.2020	Year Ended 31.03.2021	Quarter Ended 30.06.2021	Quarter Ended 30.06.2020	Year Ended 31.03.2021
		Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Audited
1.	Total income from Operations (Net)	3,491.0	1,589.9	10,308.8	3,248.6	1,454.6	9,266.5
2.	Net profit / (loss) before Tax (before exceptional and extraordinary items)	1,859.7	264.9	3,968.0	1,583.5	210.9	3,408.3
3.	Net profit / (loss) before Tax (after exceptional and extraordinary items)	1,859.7	264.5	3,482.8	1,583.5	210.6	2,924.7
4.	Net profit / (loss) after Tax (after exceptional and extraordinary items)	1,351.5	188.7	2,434.6	1,162.6	145.9	2,039.7
5.	Total Comprehensive Income [Comprising profit/loss for the period (after tax) and other comprehensive income (after tax)]	1,509.0	193.4	2,572.7	1,320.2	150.6	2,178.0
6.	Paid-up Equity Share Capital	3,104.95	3,104.95	3,104.95	3,104.95	3,104.95	3,104.95
7.	Earnings per Equity Share (Rs.)						
	(i) Basic (after extra-ordinary items)	4.86	0.62	8.29	4.25	0.48	7.01
	(ii) Diluted (after extra-ordinary items)	4.86	0.62	8.29	4.25	0.48	7.01

Note: The above is an extract of the detailed format of Quarterly Unaudited Results filed with BSE Limited under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the following weblinks:
1) On the BSE Limited: <https://beta.bseindia.com/stock-share-price/monarch-network-capital-ltd/monarch/511551/>;
2) On Company's website: <https://www.mnclgroup.com/investor-relation/investor-relation-financials-quarterly-results>.
3) AIF related disclaimer: i) MNCL Capital Compounder Fund (SEBI Registration No. IN/IF3/20-21/0787) is the maiden fund only Cat 3 AIF Equity Fund of Monarch. AIF which in turn is sponsored by Monarch Network Capital, ii) Fund inception date is 23rd Oct, 2020 and AIF returns are from 23rd Oct, 2020 to 26th July 2021, iii) Returns are net of fees and transaction costs and includes dividend income but are on pre-tax basis, iv) Nifty50 TRI returns on pre-tax basis during the same period stood at 34.4%.

By order of the Board of Directors
For Monarch Network Capital Limited
Sd/-
Vaibhav Shah
Managing Director
DIN: 00572666



બંને ટીમોને આઈસોલેટ કરાઈ કૃષ્ણાલ પંડ્યા કોરોના પોઝિટિવ ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટી-૨૦ રફ તમામ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો આજે મેચ રમાઈ શકે

કોલંબો, તા.૨૭
ટીમ ઈન્ડિયાનો ખેલાડી કૃષ્ણાલ પંડ્યા કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે બીજી ટી-૨૦ મેચ રમાવાની હતી પરંતુ તેને રદ કરવામાં આવી છે. કૃષ્ણાલ પંડ્યા કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે મેચને રદ કરવામાં આવી છે. આ સાથે જ ભારત અને શ્રીલંકાની ટીમો આઈસોલેશનમાં જતી રહી છે. પ્રથમ ટી-૨૦ મેચ જીતીને ટીમ ઈન્ડિયા ત્રણ મેચોની ટી-૨૦ સીરીઝમાં ૧-૦ થી લીડ બનાવી ચૂકી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી સીરીઝ પર ખતરો મંડરાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા ૨૦૧૬ પછી વિરાટ-રોહિતની ગેરહાજરીમાં ટી-૨૦ સિરીઝ રમવા ઉતરી છે. છેલ્લીવાર ઈન્ડિયન ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ઝીમ્બાબ્વે વિરુદ્ધ ૩ મેચની ટી-૨૦ સિરીઝ રમી હતી. જેમા કોહલી અને રોહિત બંને ટીમની પ્લેઈંગ-૧૧ માં સામેલ નહોતા. ઈન્ડિયા ટૂર ઓફ શ્રીલંકામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ કહેવું ઉતાવળ ગણાશે. ભારતે પ્રથમ ટી-૨૦ મુકાબલામાં જીત નોંધાવી સીરીઝ પર લીડ મેળવી હતી, પરંતુ હવે આ

ટોક્યો ઓલિમ્પિક્સમાં કુવૈતના ૫૮ વર્ષીય અબ્દુલ્લા અલ-રશીદીએ નિશાનેબાજીમાં કાંસ્ય પદક જીત્યો

ટોક્યો, તા.૨૭
ટોક્યોમાં રમાઈ રહેલી ૩૨મી ઓલિમ્પિક્સ ગેમમાં ઉમર માત્ર આંકડો બનીને રહી ગઈ છે. કાલે ટોક્યો ઓલિમ્પિક્સમાં ૧૩ વર્ષની મોમોજિ નિશિયાએ મેડલ જીત્યું હતું. વળી, આજે કુવૈતના ૫૮ વર્ષના નિશાનેબાજ અબ્દુલ્લા અલ રશીદીએ નિશાનેબાજીમાં કાંસ્ય પદક પર પોતાનો કબજો જમાવ્યો છે. કુવૈતના સાત વારના આ ઓલિમ્પિયને પુરુષોની સ્કીટ નિશાનેબાજીની સ્પર્ધામાં કાંસ્ય પદક પોતાના નામે કર્યું. મેડલ જીત્યા બાદ રશીદીએ વધુ દિલ્લચ્ચ નિવેદન આપ્યું, તેમને કહ્યું- તે ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિક્સમાં પણ ભાગ લેશે અને તે સમયે તેનું નિશાન ગોલ્ડ પર હશે. રશીદીના ૨૦૨૪ ઓલિમ્પિક્સમાં ૬૧ વર્ષ થઈ જશે. કાંસ્ય પદક જીત્યા બાદ રશીદીએ કહ્યું, હું ૫૮ વર્ષનો છું. સૌથી વૃદ્ધ નિશાનેબાજ છુ આવામાં આ કાંસ્ય પદક હુ આ મેડલથી પુશ છુ પરણ આગળના ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીશ. કાંસ્ય પદક જીત્યો હતો, પરંતુ તે સ્વતંત્ર નથી જીતી શક્યો પરંતુ હું કાંસ્ય પદકથી પુશ છુ. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ માં હુ



હું ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિક્સમાં પણ ભાગ લઈશ : રશીદી

ગોલ્ડ મેડલ જીતીશ. હું તે સમયે ૬૧ વર્ષનો કહ્યું, હું ૫૮ વર્ષનો છું. સૌથી વૃદ્ધ નિશાનેબાજ છુ આવામાં આ કાંસ્ય પદક હુ આ મેડલથી પુશ છુ પરણ આગળના ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીશ. કાંસ્ય પદક જીત્યો હતો, પરંતુ તે સ્વતંત્ર નથી જીતી શક્યો પરંતુ હું કાંસ્ય પદકથી પુશ છુ. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ માં હુ

કુવૈત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કુવૈત માટે મેડલ જીતવા પર તેમને કહ્યું રિયો પણ મુકાબલો કરીશ. કુવૈતના અલ રશીદીએ ઓલિમ્પિક્સમાં પહેલીવાર ૧૯૮૬માં ભાગ લીધો હતો. તેમને રિયો ઓલિમ્પિક્સ ૨૦૧૬માં પણ નિશાનેબાજીમાં કાંસ્ય પદક જીત્યો હતો, પરંતુ તે સ્વતંત્ર ખેલાડી તરીકે ઉતરી હતા. ખરેખરમાં તે સમયે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ

MONARCH NETWORK CAPITAL
Monarch Network Capital Limited
CIN: L65920GJ1993PLC120014

Regd. Office: Unit No. P04-01D, 4th Floor, Tower A, WTC GIFT CITY, Block No. 51, Road 5 E, Zone-5, Gandhinagar - 382355, Gujarat
Corporate/ Communication Address: "Monarch House", Opp Prahladhhai Patel garden, Near Ishwar Bhuvan, Commerce Six Roads, Navrangpura, Ahmedabad - 380009
Tel No.: 91-079-2666500; Email: cs@mnclgroup.com; Website: www.mnclgroup.com

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2021
(Rs. In Lacs except EPS)

Sr. No.	Particulars	Consolidated			Standalone		
		Quarter Ended 30.06.2021	Quarter Ended 30.06.2020	Year Ended 31.03.2021	Quarter Ended 30.06.2021	Quarter Ended 30.06.2020	Year Ended 31.03.2021
		Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Audited
1.	Total income from Operations (Net)	3,491.0	1,589.9	10,308.8	3,248.6	1,454.6	9,266.5
2.	Net profit / (loss) before Tax (before exceptional and extraordinary items)	1,859.7	264.9	3,968.0	1,583.5	210.9	3,408.3
3.	Net profit / (loss) before Tax (after exceptional and extraordinary items)	1,859.7	264.5	3,482.8	1,583.5	210.6	2,924.7
4.	Net profit / (loss) after Tax (after exceptional and extraordinary items)	1,351.5	188.7	2,434.6	1,162.6	145.9	2,039.7
5.	Total Comprehensive Income [Comprising profit/loss for the period (after tax) and other comprehensive income (after tax)]	1,509.0	193.4	2,572.7	1,320.2	150.6	2,178.0
6.	Paid-up Equity Share Capital	3,104.95	3,104.95	3,104.95	3,104.95	3,104.95	3,104.95
7.	Earnings per Equity Share (Rs.)						
	(i) Basic (after extra-ordinary items)	4.86	0.62	8.29	4.25	0.48	7.01
	(ii) Diluted (after extra-ordinary items)	4.86	0.62	8.29	4.25	0.48	7.01

Note: The above is an extract of the detailed format of Quarterly Unaudited Results filed with BSE Limited under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the following weblinks:
1) On the BSE Limited: <https://beta.bseindia.com/stock-share-price/monarch-network-capital-ltd/monarch/511551/>;
2) On Company's website: <https://www.mnclgroup.com/investor-relation/investor-relation-financials-quarterly-results>.
3) AIF related disclaimer: i) MNCL Capital Compounder Fund (SEBI Registration No. IN/IF3/20-21/0787) is the maiden fund only Cat 3 AIF Equity Fund of Monarch. AIF which in turn is sponsored by Monarch Network Capital, ii) Fund inception date is 23rd Oct, 2020 and AIF returns are from 23rd Oct, 2020 to 26th July 2021, iii) Returns are net of fees and transaction costs and includes dividend income but are on pre-tax basis, iv) Nifty50 TRI returns on pre-tax basis during the same period stood at 34.4%.

By order of the Board of Directors
For Monarch Network Capital Limited
Sd/-
Vaibhav Shah
Managing Director
DIN: 00572666

Committed to delivering value

119.6%
Total Income

7.8x
Profit After Tax*

54.7%
AIF Returns # (since Oct'20)

4.86**
EPS (in Rs.)

Consolidated nos. *PAT after OCI **Not annualised

Place : Ahmedabad
Date : 27th July, 2021

આઈએમએફની વિશ્વ અર્થતંત્રનો વૃદ્ધિ દર છ ટકા રહેવાની આગાહી

ઓલિમ્પિક શરૂ થયાના બીજે દિવસે જ ટોકિયોમાં કોરોનાના ૨૮૪૮ કેસો

ટોકિયો, તા. ૨૭ - જાપાનના પાટનગરમાં ઓલિમ્પિકનો આરંભ થયાના બીજે જ દિવસે ટોકિયોમાં કોરોનાના નવા સૌથી વધારે ૨,૮૪૮ દૈનિક કેસો નોંધાયા છે. જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ ટોકિયો, તા. ૨૭ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની તાકીદ કરી છે પણ ઓલિમ્પિક ગેમ્સને સમ્પન્ન કરવામાં આવશે તેમ વિચારવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું. તેમણે લોકોને ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન આચરવાનું કાર્યો બંધ રાખવાનું કહ્યું હતું.

જાપાનના પાટનગરમાં ઓલિમ્પિકનો આરંભ થયાના બીજે જ દિવસે ટોકિયોમાં કોરોનાના નવા સૌથી વધારે ૨,૮૪૮ દૈનિક કેસો નોંધાયા છે. જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ ટોકિયો, તા. ૨૭ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની તાકીદ કરી છે પણ ઓલિમ્પિક ગેમ્સને સમ્પન્ન કરવામાં આવશે તેમ વિચારવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું. તેમણે લોકોને ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન આચરવાનું કાર્યો બંધ રાખવાનું કહ્યું હતું.

જાપાનના પાટનગરમાં ઓલિમ્પિકનો આરંભ થયાના બીજે જ દિવસે ટોકિયોમાં કોરોનાના નવા સૌથી વધારે ૨,૮૪૮ દૈનિક કેસો નોંધાયા છે. જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ ટોકિયો, તા. ૨૭ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની તાકીદ કરી છે પણ ઓલિમ્પિક ગેમ્સને સમ્પન્ન કરવામાં આવશે તેમ વિચારવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું. તેમણે લોકોને ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન આચરવાનું કાર્યો બંધ રાખવાનું કહ્યું હતું.

જાપાનના પાટનગરમાં ઓલિમ્પિકનો આરંભ થયાના બીજે જ દિવસે ટોકિયોમાં કોરોનાના નવા સૌથી વધારે ૨,૮૪૮ દૈનિક કેસો નોંધાયા છે. જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ ટોકિયો, તા. ૨૭ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની તાકીદ કરી છે પણ ઓલિમ્પિક ગેમ્સને સમ્પન્ન કરવામાં આવશે તેમ વિચારવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું. તેમણે લોકોને ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન આચરવાનું કાર્યો બંધ રાખવાનું કહ્યું હતું.



કોંગ્રેસના નવા સુકાની નવજોતસિંઘ સિદ્ધુ અને પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર વરચે મંગળવારે સચિવાલય ખાતે મુલાકાત થઈ હતી. આ બેઠકમાં બંનેને પારસ્પરિક મતભેદો ભૂલાવીને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને જીતવા માટે યોજાવાની પ્રતિબદ્ધતા દાખવી હતી.

મરજીથી કોઈ ભીખ નથી માગતું, રસ્તા પરથી ભીક્ષુકોને ન હટાવી શકાય: સુપ્રીમ

નવી દિલ્હી, તા. ૨૭ - ભિખુઓને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ હતી, જેમાં વિચિત્ર માગ કરતા અરજદારે કહ્યું હતું કે જાહેર સ્થળોએ ભિક્ષા માગવા પર પ્રતિબંધ મુકવો જોઈએ. આ માગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને સાથે અરજદારને ટક્કર કરતા કહ્યું હતું કે કોઈ પોતાની મરજીથી ભીખ

નથી માગતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે એવો દ્રષ્ટિકોણ ન રાખી શકીએ કે કોઈ પણ ભીખ માગનારી વ્યક્તિ રસ્તા પર ન દેખાવી જોઈએ. ભીખ માગવી તે સામાજિક અને આર્થિક સમસ્યા છે. શિક્ષણ અને રોજગારીના અભાવે કેટલાક લોકો પોતાની ભૂખભૂત જરૂરિયાતો પુરી કરવા માટે ભીક્ષા માગવા માટે મજબૂર થાય છે.

મમતા સીએમ બન્યા પછી મોદીને દિલ્હીમાં પહેલી વખત મળ્યા

પશ્ચિમ બંગાળમાં સીએમનું પદ સંભાળ્યા પછી મમતા બેનરજીએ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. રાજ્યમાં સીએમનું પદ સંભાળ્યા પછી તે પહેલી વખત દિલ્હી આવ્યા છે. આ પહેલા મમતા બેનરજીએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે પણ ટીએમસી પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા આનંદ શર્માએ પણ મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી. ૨૦૨૧ની લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનરજી રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા ભજવવાની તૈયારીમાં છે. મમતા બેનરજી સાથે મુલાકાત પછી કમલનાથે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે ૨૦૨૧ની રણનીતિની ચર્ચા સોનિયા ગાંધી સાથે થશે. મમતા બેનરજી ભુપવારે સવારે સોનિયા ગાંધીને મળશે. કમલનાથે જણાવ્યું હતું કે મમતા બેનરજી સાથે તેમના જુના સંબંધ છે અને તે તેમને આમંત્રણ આપવા આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મમતા બેનરજી સાથે દેશમાં મોંઘવારી, કાયદો અને વ્યવસ્થા, દબાવવા અને ઈશ્ટિવાના રાજકારણના મુદ્દા પર ચર્ચા થઈ શકે.

ક્રિપ્ટો કરન્સી બજારમાં એકધારી તેજીને વાગેલી બ્રેક બિટકોઇન ૪૦ હજાર ડોલર કુદાવી ગયા પછી ઉંચેથી ૪૦૦૦ ડોલર તૂટ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. ૨૭ - ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે પાછલા વર્ષા દિવસની એકધારી આગેકૂચને બ્રેક લાગી હતી તથા ઉંચા મથાળેથી ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. બિટકોઇનના ભાવ જે ઉંચામાં એક તબક્કે ૪૦ હજાર ડોલરની સપાટી પાર કરી ગયા હતા તે ઉંચા મથાળેથી ૪૦૦૦ ડોલર તૂટ્યા પછી ફરી ૨૦૦૦ ડોલર વધી જતાં ભાવમાં વ્યાપક ઉછળકૂટ જોવા મળી હતી.

ઈકોમસ જાવન્ટે ક્રિપ્ટો સ્વીકારવાની યોજના નહિં હોવાનું જણાવતાં ઉંચા મથાળે બજારમાં નફારૂપી વેચવાલી

વૈશ્વિક મોટી ઈ-કોમર્સ કંપની ક્રિપ્ટો કરન્સી સ્વીકારશે એવા સંકેતો ગઈકાલે વહેતા થયા પછી આજે કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તુરંત આવી કોઈ નક્કર યોજના નથી. આના પગલે બિટકોઇનમાં ઉંચા મથાળે વેચવાલી નિકળી હતી. બિટકોઇનના ભાવ ઉંચામાં ૪૦૫૩૭થી ૪૦૫૪૦ ડોલર થયા પછી નીચામાં ભાવ ગભરી ૩૬૪૧૮ થી ૩૬૪૨૦ ડોલર થઈ ઉતર પડ્યો હતો. ટ્રેડિંગ વોલ્યુમ શ્રેકે વધી આજે ૪૩થી ૪૪ અબજ ડોલર થયું હતું. સામે માર્કેટ કેપ પણ વધી ૭૨૩થી ૭૨૪ અબજ ડોલર નોંધાયું હતું. દરમિયાન અમેરિકામાં ફંડરલ રિઝર્વની બે દિવસથી મિટિંગ મંગળવારે શરૂ થઈ છે જે બુધવારે આજે સમાપ્ત થશે ત્યારે આ મિટિંગમાં ફંગાવો, વ્યાજના દર તથા બોન્ડ બાઈંગ ઘટાડવા વિશે કેવા સંકેતો આપવામાં આવે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. દરમિયાન, બિટકોઇનમાં સોમવારે આવેલા ભાવ ઉછાળામાં મંદીવાળાના આચરણે લપ ક્રોડ ડોલરના વેચાણો કપાયાના નિર્દેશો મળ્યા હતા.

દિલ્હીની વાત (પહેલા પાનાનું ચાલુ)

સરકારો જે ન કરી શકી એ શાહ ચપટી વગાડીને સ્ટ્રી બનાવશે એવો માહિલા ઉભો કરી દેવાયો હતો. શહનની મુલાકાત દરમિયાન આ વિવાદ ઉકેલવા માટે કોઈ ના જ થયું પણ શાહ દિલ્હી પાછા આવ્યા તેના ૨૪ કલાકમાં તો પહેલા કદી નહોતી બની એવી અજુગતી ઘટના બની ગઈ.

બે દેશના સૈનિકો સામસામે લડતા હોય એ રીતે પોલીસો સામસામે આવી ગયા.

બંને રાજ્યોમાં ભાજપની સરકારો હોવા છતાં વાત આ હદે પહોંચી એ ભાજપ માટે શરમજનક છે.

યુપીમાં જીવાત મોદીનું ઓબીસી-ઈડબલ્યુએસ કાર્ડ

ઉત્તર પ્રદેશમાં યૂટીપી જીવાત માટે નરેન્દ્ર મોદીએ મોટા પાયે ઓબીસી તથા ઈડબલ્યુએસ કાર્ડ રમવાની તૈયારી કરી લીધી છે. તેના ભાગરૂપે મોદીએ મેડિકલ કોલેજોમાં પ્રવેશમાં આવે ઈન્ડિયા ક્વોટામાં ઓબીસીને પણ પ્રવેશ આપવાની જોગવાઈ ત્રણ મહિનામાં કરવા અહિંમેટમ આપ્યું છે. સાથે સાથે સર્વણી માટેની ઈડબલ્યુએસ અનામતનો અમલ કરવા પણ તાકીદ કરી છે.

આ મુદ્દો શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાય મંત્રાલય સાથે જોડાયેલો છે. મોદીએ સોમવારે અચાનક આ મત મંત્રાલયની બેઠક બોલાવીને મેડિકલ ક્વોટામાં ઓબીસી અનામતનું શું સ્ટેટસ છે તેની વિગતો માગીને ક્લાસ લઈ લીધો. આ મુદ્દો અત્યારે કોર્ટમાં છે એવી દલીલ કરનારા અધિકારીઓને મોદીએ તત્કાલે કોર્ટ બહાર ઉકેલવા વાત તાકીદ કરી.

હાલમાં મેડિકલ અભ્યાસક્રમોમાં એમબીબીએસ સહિત અંદર ગ્રેજ્યુએટ કોર્સિસમાં ૧૫ ટકા અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ૫૦ ટકા બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ અનામત રાખાય છે આ બેઠકોમાં એસસી-એસટી માટે અનામત છે પણ ઓબીસી માટે અનામત નથી તેથી ઓબીસી નારાજ છે. મોદી આ નારાજગી યુપીની યૂટીપી પહેલાં દૂર કરવા માગે છે.

રાહુલની ટ્રેક્ટર કૂચ, મોદી ભડકતાં પોલીસ ધંધે લાગી

રાહુલ ગાંધીએ સોમવારે કરેલી ટ્રેક્ટર કૂચ દિલ્હી પોલીસની ઉંચ દરામ કરી દીધી છે. રાહુલ ગાંધી ટ્રેક્ટર લઈને છેક સંસદ સુધી પહોંચી ગયા તેના કારણે ભડકવા મોદીએ અભિત્ર શહનો જાણ માગતાં શાહે દિલ્હી પોલીસના અધિકારીઓને ખબરડાવી નાખ્યા. રાહુલની રેલીને મળેલી પબ્લિસિટીના કારણે પણ મોદી ભડક્યા છે. સંસદના સુરક્ષા ધરાવતા વિસ્તાર સુધી ટ્રેક્ટર આવી ગયું તે દિલ્હી પોલીસને તેની ગંધ સુધી કેમ ના આવી એ મુદ્દે શાહે જાણ માગતાં દિલ્હી પોલીસ બરાબરની ધંધે લાગી છે. શાહે આ પુછ માટે જવાબદાર પોલીસોમાં નામ ત્રણ દિવસમાં આપવા ફરમાન કર્યું છે એ જોતાં લીડ-એન્ડમાં દિલ્હી પોલીસને કેટલાકનો વારો પડી જશે એ નક્કી છે.

દિલ્હી પોલીસ અત્યારે સીસીટીવી ચકાસવામાં લાગી છે. સીસીટીવીમાં રાહુલના ધર-સુધી ટ્રેક્ટર મોટી કન્ટેઈનર ટ્રેકમાં લવાયું હતું એ ખબર પડી છે. ટ્રકને દિલ્હીમાં આવવા દેવા એક સંસદ પોલીસના ઉચ્ચાધિકારીને ભલામણ કરી હતી. તપાસ હવે આ અધિકારી કોણ તેના પર કેન્દ્રિત થઈ છે.

કોંગ્રેસ-ત્રણમૂલ કોંગ્રેસના જોડાણનો તખ્તો તૈયાર

દિલ્હી પહોંચેલાં મમતા બેનરજી મંગળવારે સવારે સોનિયા ગાંધીને મળે ત્યારે ત્રણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચેના જોડાણને અંતિમ રૂપ આપશે એવો સૂત્રોનો દાવો છે. મમતાએ મંગળવારે પોતાના ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી લીધી છે. બંગાળની ચૂંટણીમાં કારમી હાર પછી સોનિયા બંગાળમાં પોતાનો પગ ટકી રહે એ માટે મમતા જે પણ આપે તે લઈને જોડાણ માટે તૈયાર હોવાનો સૂત્રોનો દાવો છે. મમતા સોમવારે સાંજે દિલ્હી આવ્યાં પછી મમતા સાથે તેમની ફોન પર વાત થઈ હતી. આ વાતચીતમાં સોનિયાએ પોતાના વિશ્વાસુ કમલનાથ અને અભિષેક મનુ સિંઘવી સાથે જોડાણ મુદ્દે ચર્ચા કરવા વિનંતી કરતાં મમતાએ હા પાડી હતી. કમલનાથ અને સિંઘવી મમતાને અલગ અલગ મળ્યા હતા. મમતાએ તેમની સાથે જોડાણની શરતો અંગે પ્રાથમિક ચર્ચા કરી છે. કોંગ્રેસમાંથી આનંદ શર્મા પણ મમતાને મળ્યા હતા. મમતાએ શર્માને સોનિયા ગાંધીના હાથ મજબૂત કરીને ભાજપ સામે પૂરી તાકાતથી લડવા સલાહ આપી હોવાનો સૂત્રોનો દાવો છે.

સિંદેહની લડાઈ સોનિયાના દરબારમાં પહોંચી છે

સિંદેહની લડાઈ સોનિયાના દરબારમાં પહોંચી છે. બહેનના સમર્થક ધારાસભ્યો બુદ્ધિપતિ સિંહે સાક્ષેપ મુક્યો હતો કે, સિંદેહવ મારી હત્યા કરાવીને છીતીસગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખરાબ છે એવું સાબિત કરીને મુખ્યમંત્રી બનવા માગે છે.

આ આક્ષેપથી અડગાયેલા સિંદેહે મંગળવારે પોતાની જ સરકાર સામે વોક્આઉટ કરીને એલાન કર્યું કે, બહેલ સરકાર આ યુદ્ધે ગુલમાં નિવેદન નહીં કરે ત્યાં સુધી પોતે ગુલમાં હાજર નહીં રહે. ‘બાબા’ તરીકે જાણીતા સિંદેહવના એલાનના પગલે તેમના સમર્થકોમાં આકોશ છે.

વોક્આઉટ પછી સિંદેહે દિલ્હી જવા નિકળી ગયા. સિંદેહવ સોનિયા ગાંધી સામે બહેલ ઉપરાંત પ્રદેશ પ્રભારી પી. એલ. પુનિયાની પણ ફરિયાદ કરશે એવો સૂત્રોનો દાવો છે. બહેલવ સાથે સિંદેહના આક્ષેપ પછી રાયપુર આવેલા પુનિયા બહેલને મળ્યા હતા અને બુદ્ધિપતિને પણ મળ્યા પણ સિંદેહવને નહોતા મળ્યા. પુનિયાએ સિંદેહવ સામેના આક્ષેપોને રોકવા કોઈ પગલાં ના લીધાં કે હાઈકમાન્ડને પણ આ મુદ્દે રીપોર્ટ ના મોકલતાં સિંદેહવ તેમના પર પણ બગાડ છે.

ગેહલોતના મંત્રીનો દાવો, ૪-૫ દિવસનો મહેમાન છું.....

રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાનનો તખ્તો તૈયાર હોવાનો સંકેત ગેહલોતના ખાસ અધિકારી ગોવિંદસિંહ ડોટાસરાએ આપ્યો છે. આ વિસ્તરણમાં પોતાનો ભોગ લેવાઈ જશે એવો સંકેત પણ ડોટાસરાએ આપ્યો છે. ડોટાસરા હાલમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ છે અને સાથે સાથે રાજ્યના શિક્ષણ મંત્રી પણ છે. ડોટાસરાનો એક વીડિયો હમણાં વાયરલ થયો છે જેમાં ડોટાસરા પોતે શિક્ષણ વિભાગમાં ચાર-પાંચ દિવસના મહેમાન હોવાનું કહે છે. કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠકમાં ડોટાસરા એવું બોલતા સંભળાય છે કે, તમારી ફાઈલ હોય તો લઈ આવજો, હું એક મિનિટમાં ક્લીયર કરી દઈશ. હું ચાર-પાંચ દિવસનો મહેમાન છું ને એ દરમિયાન મારાથી તમારા માટે બનશે એ બધું હું કરી છૂટીશ. ડોટાસરાને સચિન પાયલોટને હટાવીને પ્રદેશ પ્રમુખ બનાવવા હતા. ડોટાસરાએ ગેહલોતના ઈશારે પાયલોટ સામે લીધેલા આકરા વલણના કારણે પાયલોટ જૂથ ડોટાસરાને પ્રદેશ પ્રમુખપદેથી હટાવવા માગે છે. સામે ગેહલોત ગને તે ભોગે ડોટાસરાને ચાલુ રાખવા માગે છે કે જેથી સંગઠન પર તેમનું વર્ચસ્વ જળવાઈ રહે. ***

બેનરજી આજે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા

બેનરજી આજે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. હવે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની તેમની આવીતકાલે થનારી મુલાકાતને લઈને ઘણી ઉત્કુહતા જોવા મળી રહી છે. ટીએમસીએ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં બન્યા વિજય મેળવ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી બેઠક હશે. શ્રે કે કોંગ્રેસ અને ટીએમસી વચ્ચેના સંબંધો ખરાબ હતા ત્યારે પણ સોનિયા ગાંધી અને મમતા વચ્ચેના સંબંધો ઘણા સારા હતા. બેઠકનો કોઈ એનજી ડિક્કર નથી. બંને નેતાઓ આગામી રાષ્ટ્રીય ચૂંટણીમાં એલાનમાં રાખીને વિષાખા બ્લોકના લાંબા ગાળાના ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરે તેમ મનાય છે. આ બેઠકનું મહત્વ એટલા માટે છે કેમકે હાલમાં સંસદના ચાલી રહેલા સત્રમાં સરકાર સામે વિપક્ષ ગેહલોતને કોંગ્રેસની કાંડને લઈને અને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરવાને લઈને મોટાપાયે પર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ વચ્ચેથી હાજરી આપી શકે છે. બેનરજીના રાહુલ ગાંધી સાથેના સંબંધો બુદ્ધિપતિ સાચા નથી ત્યારે પ્રશાંત કિશોર તેમના મધ્યસ્થિની ભૂમિકા અદા કરી શકે છે.

જુલાઈમાં રસીનો લક્ષ્યાંક ગુમાવશે તેવા અહેવાલોને કેન્દ્રને ફગાવ્યા

સરકારે મંગળવારે ભારતે જુલાઈના અંતે ૫૦ કરોડ કોવિડ રસીના ડોઝનો લક્ષ્યાંક ચૂકી જશે તેવા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે. સરકારે આ અહેવાલોને અપુરતી માહિતીવાળા અને મોટા ગણવાતા ભારપૂર્ક જણાવ્યું હતું કે ૩૧ જુલાઈના અંત સુધીમાં

વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી હતી

વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી હતી કે ભાજપ પાસવાનની એલજેપીનો ઉપયોગ રાજ્યમાં જટ્યુનો વોટરોર કાપવા માટે કર્યો અને આ રીતે નીતિશકુમારની પાંખો કાપી નાખી હતી. એલજેપીને નીતિશકુમારને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તેણે જટ્યુ સામે રીનસરનું અભિમાન આદર્યું હતું.

રાહુલની જાભ ફરીથી લપસી: મોદી સરકારના વખાણ કરી દીધા

રાજ્યના રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાની ભૂલો માટે પ્રખ્યાત છે. આ જ મોરચે તેમણે વધુ એક ભૂલ કરી છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્રમણ કરતા પીએમ પર તીખો હુમલો કર્યો, પરંતુ અંતે તેમની પ્રશંસા કરતા ભાજપને તેમની ટીકા કરવાનો પૂરતો દારુગોળો

મળી ગયો છે. તેમણે પેગાસસ જાસૂસી મુદ્દે મોદી સરકાર પર હુમલો બોલાવ્યો હતો

મળી ગયો છે. તેમણે પેગાસસ જાસૂસી મુદ્દે મોદી સરકાર પર હુમલો બોલાવ્યો હતો, પણ સંસદની બહાર પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે તેમને આ અંગે ચિંતા છે. તેમણે જણાવ્યું હતું કે મને કોઈ ડર નથી. મને કોઈ ધમકી મળી નથી.

આ દેશમાં જે તેમ બ્રેક હોવ અને ચોર હોય તો જ તમારે મોટીથી ડરવું પડશે. જે તે તેમના ક્યું ન હોવ તો આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાએ આ માટે રાહુલ ગાંધીને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી પોતે સ્વીકારે છે કે બ્રેક લોકોએ મોદી સરકારથી કરવું પડશે. તેની સાથે તેમણે આમ બોલતા રાહુલ ગાંધીનો વિડીયો પણ ટવીટ કર્યો હતો.

- ઈન્દર સાહની

eTender offer for salvage of Water affected CR COILS and CR Profile.

Online eTender is available on www.prosal.in for material of M/s. THE PRECISION STEEL INDIA PRIVATE LIMITED, from interested buyers for disposal of Water affected CR coils and CR Profile on "AS IS WHERE IS BASIS" lying at M/s. THE Precision Steel India Private Limited, 1522-NH, No-48, Opp. GIDC, PO-Kablipore, Navsari-396424, Gujarat. Buyers would be able to bid (multiple times) during last 60 minutes on last day of eTender. Refer terms & conditions mentioned on www.prosal.in Salvage can be inspected from 28th July to 11th August 2021 between 10 AM to 5 PM with prior appointment with Mr. Kishor Kabra Mobile: 9403231405 & Mr. Vishal Rana Mobile: 9099075619. eTender bidding will be enabled from 03:00 to 04:00 pm for CR coils & 04:15 to 05:15 pm for CR Profile: (both for 60 minutes only) on 13th August 2021. Address where DD to be sent: E-5, 5th Floor, SAR Corporate Center, Nr. Shastri Nagar, Vidhana Main Road, Surat - 395 002. (Mr. Hardik Patel 0261-2343686).

IDEAL VENUE FOR MARRIAGES, CONFERENCES & RELAXATION @



Khanvel
RESORT SILVASA

079-48964488, 09377065994, 09824055861
sales@khanvelresort.com
www.khanvelresort.com

ધી સુરેન્દ્રનગર પીપલ્સ કો.ઓ. બેંક.લી. (કંડામાં), સુરેન્દ્રનગર વહીવટી કચેરી, જી.આઈ.ડી.સી. શાખા બિલ્ડીંગ, જી.આઈ.ડી.સી. વડવાણ રોડ, વડવાણ-૩૬૩૦૩૫ મો.નં.૯૧૭૩૩ ૨૨૭૫૯

ઓનલાઈન જાહેર નિવેદન : નંબર ૩ (૨૦૨૧-૨૨)

સરકાર બેંકની માહિતીમાં જી.આઈ.ડી.સી. શાખા બિલ્ડીંગ, વડવાણ ખાતે આવેલ મકાન અંગે ફરિયાદો આટોપવામાં હેતુસર, સરકારે કંડા બેંકની નિલકાતમાં નિલકાત માટે રચાયેલ રાજ્યકક્ષાની સમિતિ દ્વારા સર્વભૂખતે થયેલા ફાલ્ય મુજબ અમોને સુપ્રત કરેલ સત્તાની રૂબે, સરકારને કૈશિત સ્થાપન જમીન - મકાન (નિલકાત) નું ઓનલાઈન ઈ-ટેન્ડર ક્રમ ઈ-ઓક્સનથી વેચાણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ માટે જાહેર જનતા કે જમીન-મકાન અદિવાસીમાં રસ ધરાવતા ઓફિસરીઓ (બીડરો) પાસેથી ઓનલાઈન ઈ-ટેન્ડર અંગતપણે આપે છે. આ અંગેનાં ટેન્ડર વેબ/www.nprocure.com વેબ સાઈટ પરથી મળશે. અને આજ વેબ સાઈટ પર ઓનલાઈન ટેન્ડર ભરવાની રહેશે. ટેન્ડર અંગેનાં તમામ નિયમો અને શરતો તેમાં જોવા મળશે, તેમજ બેંક ઓફિસમાં નોટીસ બોર્ડ પર પણ જોવા મળશે. ઓનલાઈન ટેન્ડર માટેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

(1) બિલ્ડિંગ પ્લોન : સુરેન્દ્રનગર - વડવાણ રોડ પર આવેલ ધી સુરેન્દ્રનગર પીપલ્સ કો.ઓ. બેંક લી. જી.આઈ.ડી.સી. શાખા બિલ્ડિંગ (મકાન), પોસ્ટ નંબર : એ/૨૨ અને એ/૨૩, બુલ્ડિંગ નંબર : ૧૧૪૭ ચો.મી. કુલ બંધકામ : અલગ હોલ - ૩૫૮.૨૧ ચો.મી., ફર્ટ હોલ - ૨૪૦.૩૫ ચો.મી., કુલ કાચકામ - ૫૦૫.૫૬ ચો.મી.

(2) બિલ્ડિંગ અવરોધ પ્રકાર : : રૂ. ૭,૩૧,૨૦,૦૦૦/-

(3) ઈ.એમ.ડી.ની રકમ : : રૂ. ૩૮,૦૦,૦૦૦/-

(૪) ટેન્ડર બી ટી રકમ : : રૂ. ૨૫,૦૦૦/-

(5) online submission Date : તા.૨૮/૦૭/૨૦૨૧ થી તા.૧૨/૦૮/૨૦૨૧

(6) Physically એક્ષેન્ડે મોકલવાની (પહોંચાવવાની) તારીખ : ૨૩/૦૮/૨૦૨૧ સંજવા ૫-૦૦ કલાક સુધી

(૭) ટેન્ડર ઓનલાઈન ખોલવાની સંખિત તારીખ : તા.૦૫/૦૮/૨૦૨૧ બપોરે ૧૨-૦૦ કલાકે

(૫) Online Auction Date : તા.૦૨/૦૮/૨૦૨૧ બપોરે ૧૨-૦૦ થી ૧-૦૦ કલાક સુધી

તારીખ : ૨૮/૦૭/૨૦૨૧ સમય સમિતિ, કંડા, બેંકની બિલ્ડિંગ નિલકાત માટેની રાજ્યકક્ષાની સમિતિ સ્થળ : વડવાણ અને કંડા ઓફિસ, ધી સુરેન્દ્રનગર પીપલ્સ કો.ઓ. બેંક લી. (કંડામાં), સુરેન્દ્રનગર

જાહેર નોટિસ

ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ તથા તાલુકા બાવળાનાં મોજે ગામ કોચરીયાની સીમમાં ખાતા નં. ૧૩૬ પૈકી રી-સર્વે પ્રમાણે નવા બ્લોક નં. ૨૬૦ વાળી છે. આર. એ. પી. : ૨-૪૫-૧૧ જમીન, અભેસિંહ ઉર્ફે ધનરથયામસિંહજી ભાવુતરજી, જયદીપસિંહ ધનશ્યામસિંહ તથા સહદેવસિંહ ધનરથયામસિંહ અને તેઓની સહચારા માલિકી કમજા ભોગવતરની તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત નાકરજી હોવાનું જણાવી અમારી પાસે ટાઇટ